

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન એનિમલ સર્વિસિસ પહેલ વહેલી વખત કેનેડામાં પાલતું પ્રાણીઓ માટે હોમ ટુ હોમ™ (Home To Home™) સેવા આપશે

બ્રમ્પટન, ઓન્ટારિયો (18 જાન્યુઆરી 2021) – બ્રમ્પટન એનિમલ સર્વિસિસ હવે પ્રથમ વખત હોમ ટુ હોમ™ (Home To Home™) સેવા જે એક પાલતું પ્રાણીઓનાં માલિકો માટેની ઇન્ટરએક્ટિવ સેવા છે જેઓ હવે પ્રાણી આશ્રય સ્થાન પર પોતાના પ્રાણીઓને છોડ્યા વિના તેઓ માટે નવા હેતાળ ઘર શોધી શકશે.

હોમ ટુ હોમ™ (Home To Home™) મારફતે પાલતું પ્રાણીઓ પોતાના હાલનાં નિવાસસ્થાનમાંથી નવા ઘરે ખસેડવામાં આવે છે. હાલનાં પાલતું પ્રાણીઓનાં માલિકો અને નવા માલિકો આ ફલક પરથી જ સીધો સંવાદ સાધી શકે છે જેથી તેઓ પ્રાણીઓ વિશેની પ્રત્યક્ષ માહિતીની આપ-લે કરી શકે અને પોતાનાં પ્રાણીઓને ઉચિત રીતે ખસેડી શકે.

આ નવા ઘર શોધવાની વેબસાઈટ બ્રમ્પટનનાં પાળેલા પ્રાણીઓનાં એવા માલિકોને મદદ કરશે જેઓ પોતાનાં પ્રાણીઓને માટે નવું ઘર શોધતા હોય આ પ્રાણીઓમાં સામેલ છે શ્વાન, બિલાડીઓ તેમજ અન્ય પ્રાણીઓ. પ્રાણીનાં હાલનાં માલિકે ટૂંકું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે અને પ્રાણીને નવા ઘરમાં દાખલ કરવા માટે તેનું ચિત્ર અપલોડ કરવાનું હોય છે. તેવા લોકો જેઓને પાળેલા પ્રાણી પોતાને ત્યાં લાવવાની ઇચ્છા હોય અને તેની શોધ ચલાવતા હોય તેઓ હોમ ટુ હોમ™ (Home To Home™) પર ઉપલબ્ધ પાલતું પ્રાણીઓ શોધી શકે છે. બન્ને પક્ષો માટે આમ કરવું નિઃશુલ્ક રહેશે.

સિટીના હોમ ટુ હોમ™ (Home To Home™) ફલક ઉપર બ્રમ્પટન એનિમલ સર્વિસિસ જરૂર પડે દેખરેખ રાખશે. એનિમલ સર્વિસિસ ઘર બદલવાની આ પ્રક્રિયા પર સલાહ અને સૂચનો આપી શકશે. પોતાનું પાળેલું પ્રાણી સલામત રીતે નવા ઘરમાં દાખલ થાય ત્યારે માલિકોએ બ્રમ્પટન એનિમલ સર્વિસિસને જાણ કરવાની રહેશે.

હોમ ટુ હોમ™ (Home To Home™) મારફતે પ્રાણીઓને નવા ઘરમાં સ્થાપિત કરવાથી કેટલાક પાળેલા પ્રાણીઓને શેલ્ટરમાં ત્યજી દેવાની જરૂરિયાત દૂર થઈ શકે છે જે પુનઃસ્થાપનાની તમામ જરૂરિયાતો માટે યોગ્ય ના પણ હોય. જો કે, પ્રાણીઓને સીધા શેલ્ટરમાં હકીકત અનુસાર સીધા પણ ત્યજી શકાશે. વધુ માહિતી માટે કૃપા કરી બ્રમ્પટન એનિમલ સર્વિસિસનો સંપર્ક કરશો.

હોમ ટુ હોમ™ (Home To Home™) એક્સેસ કરવા માટે [અહીં](#) ક્લિક કરો. આ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે અને બ્રમ્પટન એનિમલ સર્વિસિસ એક્સેસ કરવા માટે Brampton.ca/animalservices ની મુલાકાત લેવી.

હોમ ટુ હોમ™ (Home To Home™) એક શેલ્ટર દ્વારા સર્જાયેલ એક પ્રોગ્રામ છે જેથી એવા લોકો માટે અન્ય શેલ્ટરોને સકારાત્મક વિકલ્પ પૂરો પાડી શકાય જેઓ હવે પછી પોતાના પાળેલા પ્રાણીની કાળજી લઈ શકે તેમ ન હોય. હોમ ટુ હોમ™ (Home To Home™) નેટવર્કની ઓનલાઈન મુલાકાત આના પર લેવી home-home.org.

સુવાક્યો

"હોમ ટુ હોમ™ (Home To Home™) પાળેલા પ્રાણીઓ માટે નવું ઘર શોધવાની સેવા પ્રદાન કરનાર કેનેડાનું પહેલું શહેર બનવાનું બ્રેમ્પટનને ગર્વ છે. પાળેલા પ્રાણીઓનાં માલિકોનું અને જેઓ અમારા સમુદાયમાં પાળેલા પ્રાણીઓ સાથે જોડાવા અને પ્રાણીઓ માટે હેતાળ ઘર શોધવા માંગે છે તેઓને નિ:શુલ્ક, સરળતાથી ઉપયોગ કરી શકાય એવું ફ્લક પૂરું પાડીને સશક્તિકરણ કરે છે.

– પેટ્રિક પ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન એનિમલ સર્વિસિસ હવે હોમ ટુ હોમ™ (Home To Home™) મારફત પાળેલા પ્રાણીઓ માટે નવું ઘર શોધવાના નવતર ઉપાય રજૂ કરશે. અમે આશા રાખીએ છીએ કે અમારા શેલ્ટરમાં પાળેલા પ્રાણીઓ ઓછા ત્યજવામાં આવે અને પાળેલા પ્રાણીઓ માટે બ્રેમ્પટનમાં ઝડપથી અને સહેલાઈથી ઘરો શોધવામાં આવે."

– હરકિરત સિંઘ (Harkirat Singh), સિટી કાઉન્સિલર વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"એક સુપ્રશાસિત શહેર હોવાથી, બ્રેમ્પટન સિટી હંમેશા અમારા નિવાસીઓ – અને તેઓનાં પાળેલા પ્રાણીઓ સાથે જોડાઈને વધુ કાર્યક્ષમ બનવાનાં માર્ગો શોધે છે. હોમ ટુ હોમ™ (Home To Home™) મારફતે કોઈપણ પ્રાણીને નવું ઘર પ્રદાન કરી શકાય છે ફક્ત આ પ્લેટફોર્મમાં ક્લિક કરવાનું રહે છે અને બ્રેમ્પટનનાં પાળેલા પ્રાણીઓને સદાય હુંકાળા હોય એવા ઘર મેળવવામાં મદદરૂપ થઈ શકાય છે."

– રોવેના સાન્તોસ (Rowena Santos), રિજનલ કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ખાતે હેતાળ ઘરો શોધવામાં પાળેલા પ્રાણીઓને મદદ કરવા બ્રેમ્પટન એનિમલ સર્વિસિસનાં કર્મચારીઓ સમર્પિત છે. હોમ ટુ હોમ™ (Home To Home™) સેવા દાખલ કરનાર કેનેડાનાં સૌ પ્રથમ સમુદાય તરીકે કર્મચારીઓ પાળેલા પ્રાણીઓનાં માલિકોને મદદ કરવા જરૂર હોય ત્યારે પ્રક્રિયાઓ પૂરી કરવા માટે ઉપલબ્ધ છે જેથી પાળેલા પ્રાણીઓનાં માલિકો એકબીજા સાથે સીધો સંવાદ સાધવા માટે કાબેલ બને."

– ડેવિડ બેરિક (David Barrick), મુખ્ય વહીવટી અધિકારી, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરો પૈકી એક હોવા સાથે બ્રેમ્પટન 6,50,000 લોકોનું ઘર છે અને તેમાં 70,000 વ્યાપારો છે. અમે જે કરીએ છીએ તેનું હાર્દ લોકો છે. અમને અમારા વૈવિધ્યસભર સમુદાયોથી જોમ મળે છે, અમે નિવેશ આકર્ષાએ છીએ અને અમે એવા પ્રવાસનો આરંભ કરી રહ્યા છીએ જે ટેકનોલોજીકલ અને પર્યાવરણીય

ઈનોવેશન તરફ દોરી જાય છે. અમે પ્રગતિની ભાગીદારી એક સ્વાસ્થ્યપ્રદ શહેર બનાવવા કરીએ છીએ જે સલામત હોય, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સિટી ઓફ બ્રમ્પ્ટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca